

21st November, 2025

To, To,

BSE Limited NSE Limited

PhirozeJeejebhoy Towers, Exchange Plaza, Plot No.C/1
Dalal Street, Bandra- Kurla Complex

Mumbai – 400001 Bandra (East), Mumbai 400 051 Script Code: **517571** NSE Symbol: **INDLMETER**

Sub: Newspaper Advertisement - Notice of Postal Ballot/E-Voting to the Members

Dear Sir/Madam,

In continuation of our letter dated November 20, 2025 with regard to Postal Ballot Notice of IMP Powers Limited, and pursuant to Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached newspaper advertisements published in 'Financial Express' (English Newspaper) and 'Damanganga Times' (Gujarati Newspaper) on November 21, 2025 regarding dispatch of Postal Ballot Notice along with the instructions for remote e-voting through e-mail on November 20, 2025 to those Members who have registered their email id with MUFG Intime (India) Limited (RTA) as on cut-off date i.e. November 14, 2025.

You are therefore requested to take note of the same.

Thanking you

Yours faithfully

For, IMP Powers Limited

Rakesh
Ramanlal
Shah
Digitally signed by
Rakesh Ramanlal Shah
Date: 2025.11.21
Shah
13:56:56 +05'30'

Rakesh Shah Chairman

DIN: 00421920

यन्य समायारी

વાર્ષિક ૧૦.૪૨ લાખ મે. ટનથી વધુ મત્સ્ય ઉત્પાદન સાથે

ગુજરાત દેશની બ્લૂ ઇકોનોમીમાં યોગદાન આપતું અગ્રણી રાજ્ય બન્યું

અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. ૨૦ : દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતને ભારતના મત્સ્ય ઉદ્યોગનું પાવરહાઉસ માનવામાં આવે છે. ગુજરાતની ફ્રોઝન શ્રિમ્પ (ઝીંગા), રિબન ફિશ, કટલ ફિશ અને કમાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરિણામે, ગુજરાતનો દરિયાકાંઠો આજે રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બન્યો છે.

ગત વર્ષ ૨૦૨૪-૨૫માં દરિયાઈ માછલીનું ઉત્પાદન ૭.૬૪ લાખ મેટ્રિક ટન અને અંતર્દેશીય માછલીનું ઉત્પાદન ૨.૭૮ લાખ મેટિક ટન મળીને ગજરાતમાં કલ ૧૦.૪૨ લાખ મેટ્રિક ટનથી પણ વધુ મત્સ્ય ઉત્પાદન નોંધાયું હતું. સ્ક્વિડની માંગ ચીન, યુરોપ, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યનું અમેરિકા અને જાપાન જેવા કુલ મત્સ્ય ઉત્પાદન વધીને ૧૧ દેશોમાં પુષ્કળ છે. જેથી રાજ્યના લાખ મેટ્રિક ટનથી વધુ થવાનો મત્સ્ય ઉદ્યોગે વિદેશી હૂંડિયામણ પ્રાથમિક અંદાજ છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વાર્ષિક સરેરાશ ૯.૩૦ લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું છે, જે રાજ્યની જળસંપત્તિની તાંકાત

મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે જણાવ્યં હતં કે, સાગરખેડૂઓના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર માત્ર ઉત્પાદન વધારવા પર જ નહીં, પરંતુ માછીમારોના જીવનધોરણને સુધારવા માટે પણ સતત કાર્ય કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં 'બ્લૂ ક્રાંતિ' સાકાર થઈ રહી છે. ગુજરાતનીઁ બ્લૂ ઈકોનોર્મીઁ માત્ર રાજ્ય માટે જ નહીં, પણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટેનું પણ એક

મજબૂત એન્જિન બની છે.

સશસ્ત્ર પીએસઆઇની ભરતી પ્રક્રિયા અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ. તા. ૨૦: ગુજરાત પોલીસ દળમાં જોડાવા માટે મહેનત કરી રહેલા અને સફળ થયેલા ઉમેદવારો માટે એક રાહતજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વર્ષ ૨૦૨૨ની સશસ્ત્ર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (આર્મ્ડ પીએસઆઇ) અને રિઝર્વ સશસ્ત્ર પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા પર લાગેલું કાનૂની ગ્રહણ દૂર કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે ભરતી પ્રક્રિયાને પડકારતી પાંચેય પિટિશનને ફગાવી દઈને ભરતી બોર્ડને આગળની કાર્યવાહી માટે લીલી ઝંડી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે મેરીટમાં હોવા છતાં કોર્ટ કેસને કારણે અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા હતા તેવા ઉમેદવારોને મોટી રાહત હાઈકોર્ટના આ નિર્ણયથી તે ૧,૧૯૯ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે કાનૂની અડચણો દૂર થતાં ભરતી બોર્ડ દ્વારા નિમણૂક અને તાલીમ સહિતની આગળની પ્રક્રિયાઓ ફરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય પારદર્શક ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વપર્શ સાબિત થશે.

નોંધ વર્ષ ૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા સશસ્ત્ર પોલીસ દળમાં ૧૬૨ ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી

હતી. આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર કરી હતી. કોર્ટે અવલોકનમાં નોંધ્યું રાજ્યમાંથી અંદાજે ૩૩,૦૦૦ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી મેરીટના આધારે પ્રથમ રાઉન્ડમાં ૧,૧૯૯ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જોકે, પરીક્ષાના પરિણામ બાદ કેટલાક અસફળ ઉમેદવારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પરીક્ષાની ફાઇનલ આન્સર કી (જવાબવહી) અને અમુક પ્રશ્નોની ચોકસાઈ પર સવાલો ઉભા કર્યા હતા. પાસ થવા માટે જરૂરી લઘુત્તમ લાયકાત ગુણ જે ૪૦ નક્કી કરવામાં આવ્યા હતા,

હતું કે આ અરજીઓ એવા ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી જેઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા પરંતુ નિયત માપદંડ મુજબ લાયકાત મેળવવામાં નિષ્ફળ ગયા હતા. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિયમો અને નિષ્ણાત સમિતિ દ્વારા મોટી ગેરરીતિ સાબિત થાય તે સિવાય નક્કી કરવામાં આવેલી આન્સર કીમાં કોર્ટ હસ્તક્ષેપ કરવાનું ટાળતી હોય છે. હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ પાંચેય અરજીઓને નામંજૂર કરી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, ભરતી પ્રક્રિયાના નિયમોમાં પરીક્ષા બાદ ફેરફાર તેને ઘટાડીને ૩૫ કરવાની માંગણી કરવાની માંગણી યોગ્ય નથી.

કડીની સ્કુલમાં વિદ્યાર્થીએ શિક્ષકોના ત્રાસથી બીજા માળેથી છલાંગ લગાવી

અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. ૨૦: મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં એક ગંભીર ઘટના બની છે. જેમાં એક વિદ્યાર્થીએ શાળાના બીજા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનાના ૩ દિવસ બાદ આખરે વિદ્યાર્થીના પરિજનોએ શાળાના જવાબદાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિજનોએ શાળાના સ્ટાફ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીને કોઈ

બહાર બેસાડવામાં આવ્યો હતો. જેના કારણે તે માનસિક તણાવમાં આવ્યો અને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. CHANGE OF NAME I HAVE CHANGED MY OLD NAME FROM OLD

NAME JIYA LAD TO JIYA UMESH LAD NEW NAME AS PER MY DOCUMENTS. THIS CORRECTION IS MADE FOR THE PURPOSE OF RECORD AND OFFICIAL USE INCLUDING

PASSPORT

RECORDS.

CHANGE OF NAME

OLD NAME:

JEETENDRA GOVAN

PATEL / BHANDARI

JITENDRAKUMAR GOVANBHAI

NEW NAME:

JITENDRA GOVAN PATEL

ADDRESS: 7-381, DARJIWAD, MAIN

ROAD, MOTI DAMAN.

DAMAN- 396 220.

CHANGE OF NAME

I HAVE CHANGED MY OLD NAME FROM

NUROOLHUDA TO

NEW NAME

NOORULHODA

ANSARI AS PER

DOCUMENTS

કારણસર લાફા મારીને ક્લાસની

-ઃ અગત્યની જાહેરાત :-એસબીપીપી કો-ઓપરેટીવ બેંક લી. (શિડ્યુલ બેંક)

પારસી સ્ટ્રીટ, હેડ ઓફિસ: કિલ્લા-પારડી, ૩૯૬ ૧૨૫. ફોન નંબર : ૦૨૬૦-૨૩૭૩૫૨૮, ૨૩૭૩૨૭૦, મો.નં. ૬૩૫૭૯૩૭૬૦૧

બેન્કના સભાસદો પૈકી જે હયાત ન હોય તેવા સભાસદો જો સભાસદ તરીકે ચાલુ હોય તો તેઓના વારસદારને જણાવવાનું કે આવા બિનહયાત સભાસદોના નામ સભાસદ તરીકે કમી કરાવવાની/ વારસદારના નામે સભાસદપશું ટ્રાન્સફર કરાવવાની કાર્યવાહી નજીકની શાખામાં / બેન્કની ઓફિસે આવી કરાવી લેશો.

તા.૧૯-૧૧-૨૦૨૫

PROUDLY CO-OPERATIVE

શ્રી જીતેન્દ્રકુમાર કાંતિલાલ દેસાઇ





અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ર ર ૧મું અંગદાન થયું અમારા પ્રતિનિધિ તરફથી શારદાબેનના પતિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ થતા અંગદાન થયું હતું. જે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૨૨૧મું અંગદાન હતું. કચ્છના વતની એવા ૩૩ વર્ષીય શારદાબેન મહેશ્વરીને મગજમાં હેમરેજ થતા સારવાર માટે પરીવારજનો પ્રથમ ભુજ અને ત્યારબાદ તા. ૧૮.૧૧.૨૦૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ

૧૯.૧૧.૨૦૨૫ ના રોજ તેમનું બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કર્યું હતું. સિવિલ હોસ્પિટલ અંગદાન

હતા

ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે હાજર આબુથી જામનગર લઈ જવાતુ ૯.૫૦ લાખનું MD ડ્રગ્સ ઝડપાયુ

અમારા પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. ૨૦: ગુજરાતમાં વિદેશી દારુ અને ડ્રગ્સની હેરાફેરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. બનાસકાંઠામાંથી વિભાજિત થયેલા થરાદમાં ૯.૫૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. આબુથી જામનગર લઈ જવાતું ડ્રગ્સ ખોડા ચેક પોસ્ટ નજીકથી ઝડપાયું હતું. બાઈક પર ડ્રગ્સની હેરાફેરી થતી હતી. પોલીસે ડ્રગ્સ અને બાઈક સહિત ૧૦ લાખનો મુદામાલ જપ્ત

થરાદના એસપી એસ.આર. ભારાઈએ કહ્યું હતું કે, થરાદ પોલીસે ૯.૫૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. વાહન ચેકિંગ દરમિયાન આંતર રાજ્ય બોર્ડર પરથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે આબુથી જામનગર લઈ જવાતું ડ્રગ્સ ખોડા ચેક પોસ્ટ પરથી ઝડપી પાડ્યું છે. ડ્રગ્સ માફિયાઓ બાઈક પર ડ્રગ્સની હેરાફેરી કરતા

કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ પાસેથી ૯૫ ગ્રામ ડ્રગ્સ અને બાઈક સહિત કૂલ રૂપિયા ૧૦.૦૮ લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે મુળ રાજસ્થાનના કિશન ચૌધરી અને ઓસમાન કેરને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ministry of Culture

1) Science Communicator: 06 Nos.

Consolidated Stipend : ₹35,000/- per month

શારદાબેનના પતિ શંકરભાઇ, અમદાવાદ, તા. ૨૦: ભાઈ જીગ્નેશભાઈ અને કિશો૨ભાઈ ભરાડીયાને શારદાબેન બ્રેઇન ડેડ હોવાનુ તેમજ તેમના અંગોનુ દાન કરવા સમજાવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ ૨૨૧ અંગદાન થકી કુલ ૭૩૨ અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો ૧૫૬ ચક્ષુ તેમજ ૨૬ ચામડીના દાન મળી કુલ ૧૮૨ પેશી ઓ સાથે કુલ ૯૧૪ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીન સુધી મેળવવામાં આવ્યુ છે તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જોષીએ જણાવ્યુ હતુ.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી ૧૯૫ લીવર, ૪૦૬ કીડની, ૧૮ સ્વાદ્પિંડ, ૭૧ હૃદય, ૬ હાથ, ૩૪ ફેફસાં,૨ નાનાં આંતરડાં, ૧૫૬ ચક્ષુ તથા ૨૬ ચામડીનું દાન મળ્યુ છે. આ અંગદાનથી મળેલ લીવરને શહેર ની કેડી હોસ્પિટલ અને બે કીડની ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓ માં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ ડો. જોશીએ જણાવ્યુ હતું.

મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટેટ વલસાડ (શહેર)ની કોર્ટમાં જ.મ.પ.અ.નં.૧૨૫/૨૦૨૫

અરજદાર : અર્પણા ભરતભાઈ પટેલ

રહે. પરપ, કોલસી ફળિયા, અબ્રામા, પંડિતની ચાલ, વલસાડ, તા.જી.વલસાડ

સામાવાળા : સબ - ૨જીસ્ટ્રારશ્રી વલસાડ નગરપાલિકા (જન્મ-મરણ)

<u> જન્મ-મરણ અધિનિયમ - ૧૯૬૯ ની કલમ -૧૩ (૩) અન્વયે જન્મ/</u> મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે જાહેર નોટીસ

આથી લાગતા વળગતા ઇસમોને જણાવવાનું કે, અરજદારશ્રીએ ૪ન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજી કરેલ છે કે, અરજદારશ્રી **અર્પણા ભરતભાઈ પટેલ,** રહે.પ૨૫, કોલસી ફળિયા, અબ્રામા, પંડિતની ચાલ, વલસાડ, તા.જી.વલસાડ નાઓનો જન્મ તા.૧૨/૦૭/૨૦૦૦ના રોજ મોજે. મોજે. અબ્રામા, વલસાડ ખાતે થયેલ છે. જેઓના જન્મની નોંધણી જે તે સમયે અમારા વડિલોની શરતચુકના કારણે જન્મ રજીસ્ટરમાં નોંધણી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી બાબતે કોઈને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા નિમેલ વહીવટદાર અથવા વકીલ મારફત સદરહું જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટ વલસાડ (શહેર)ની કચેરીએ વાંધો લેખીતમાં રજુ કરવાનો રહેશે. જો ઉક્ત સમય મર્યાદામાં કોઈ વાંધા નહી આવે તો કોઈને વાંધો કે હરકત નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.

આજ રોજ તા. ૧૪/૧૧/૨૦૨૫ ના રોજ મારી સહી તથા કોર્ટનો

M.Co. with Dhysica / Chamista, Mathematica /Com

સિક્કો કરીને આપ્યો. નં.એમએજી/જન્મ/રજી.નં.૧૨૫/૨૦૨૫ કોર્ટનો સક્કો મામલતદાર અને કાર્યપાલક મેજીસ્ટ્રેટ વલસાડ (શહેર)ની કચેરી,

નીરા કેન્દ્રની બાજુમાં, ધરમપુર રોડ, વલસાડ તા.વલસાડ **છ.વલસાડ - ૩૯૬૦૦૧**

એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ વલસાડ (શહેર)

મામલતદાર

जिला विज्ञान केन्द्र/DISTRICT SCIENCE CENTRE

"WALK-IN TEST" FOR INDUCTION OF SCIENCE COMMUNICATOR & TRAINEE (CRAFT) Eligible candidates may walk-in for a Written & Communication Skill Test for induction of Science Communicator and for a Written / Trade Test for induction of Trainee (Craft) to be held on 29.11.2025 at 9.30 a.m. at the above address, as per details given below:

	Qualification		Science/Life Science/Environment Science/Bio-Technology OR equivalent M.Sc. degree in Applied Science subjects from duly recognized University (Candidate must have passed M. Sc. in or after 2023)	
	Tenure		One year, may be extended for another year subject to satisfactory performance.	
2)	Trainee (Craft)	:	01) Carpenter - 01 No. 02) Fitter - 01 No. 03) Electronics - 01 No. 04) Computer Hardware & Network Maintenance - 01 No.	
	Stipend	:	₹22,000/- per month (Consolidated)	
	Educational Qualification	:	S.S.C. or Matriculation with Certificate from I.T.I. or equivalent in relevant discipline. (Candidate must have passed I.T.I. in or after 2023)	
	Tenure		One year may be extended for another year subject to	

satisfactory performance. Details of Advertisement and prescribed Application Form can be downloaded from our website http://dscdharampur.org.in & www.nehrusciencecentre.gov.in Advt.No.DSCD/03/2025

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાશને વેગ મળશે

અમદાવાદ, તા. ૨૦ : કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે. સ્ગ્ય્કના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જે ગુજરાતને મજબૂત, સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવામાં મદદ કરશે.

આ કૉન્ફરન્સ ૮-૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટમાં યોજાશે.

આ કૉન્ફરન્સમાં સિરામિક્સ, એ ન્જિનિયરિંગ, લૉ જિસ્ટિક્સ, મત્સ્યો ઘોગ. પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ખનિજો, ગ્રીન એનર્જી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, પ્લ્પ્ટ, પિત્તળનું શહેરૅ તરીકે પ્રવાસન અને સંસ્કૃતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિકાસની તકોને પ્રકાશિત કરવામાં આવશે. નીતિગત સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી સાથે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિકાસને ઝડપી

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં નાગરિકોને સુધી મહત્તમ લાભ પહોંચાડવાનો છે.

નોંધનીય છે કે રાજકોટ ગુજરાતનો ત્રીજો સૌથી મોટો જિલ્લો છે, જે મશીન ટૂલ્સ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. સમગ્ર દેશમાં અહીંથી મશીનરીને સપ્લાય કરવામાં આવે છે અને નવીનતા અને ઉદ્યોગસાહસિકતાથી MSMEs અહીં મોટાપાયે વિકસિત થયા છે. રાજકોટની બાંધણી, અજરખ અને અહીંનું લોક સંગીત પ્રવાસન અને હસ્તકલા ક્ષેત્રોને મજબૂતી આપે છે.

કચ્છ પેટ્રોકેમિકલ્સ, ૩૨ GW નવીનીકરણીય ઉર્જા, લૉજિસ્ટિક્સ અને એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રોમાં રોકાણ માટે કચ્છ એક મહત્વપર્ણ કેન્દ્ર બન્યું છે.

જામનગરને ભારતનું ઓળખવામાં આવે છે, જ્યાં ૧૫,૦૦૦ થી વધુ એકમો પિત્તાળની કામગીરી સાથે સંકળાયેલા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એશિયાની સૌથી મોટી પેટોલિયમ રિફાઇનરી અહીં સ્થિત છે. જ્યારે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ પોરબંદર કન્ટેનર કાર્ગોનું સંચાલન કરે છે.

બનાવવાની સાથે ગુજરાતના મત્સ્યોદ્યોગ, ખનિજ પ્રોસેસિંગ અને હસ્તકલા ક્ષેત્રોમાં જાણીતું સ્થળ છે.

ડુંગળીના ભાવનગર ઉત્પાદનમાં ભારતમાં અગ્રેસર છે અને અલંગમાં વિશ્વનું સૌથી મોટં શિપબ્રેકિંગ યાર્ડ છે. બોટાદ એક નવા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. સુરેન્દ્રનગર કપાસ, વરિયાળી અને મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે અને પરંપરાગત બાંધણી અને ટાંગલિયા વશાટ માટે પ્રખ્યાત

જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઇકોલોજી. અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનો સમન્વય છે. સમૃદ્ધ એગ્રો પ્રોસેસિંગના ઉદ્યોગો, ગીર અભ્યારણ્ય, ગિરનાર પર્વત અને વ્યાપક બાગાયતી ઉત્પાદનથી આ જિલ્લાઓ કૃષિ, ફુડ પ્રોસેસિંગ અને ઇકો-ટ્રરિઝમ ક્ષેત્રમાં વ્યાપક સંભાવનાઓ પ્રસ્તૂત કરે છે. અમરેલીમાં ભારતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો માટે બલ્ક અને

આઈએમપી પાવર્સ લિમિટેડ રિજસ્ટર્ડ ઓફિસ : સર્વે નં. ૨૬૩/૩/૨/૨, ગામ સાચલી, ઉંમર કુઈન રોડ, સિલ દાદરા અને નગર હવેલી - ૩૯૬ ૨૩૦

ઓફિસ : CH-7, ઇન્સ્પાચર ડિઇઝનેસ પાર્ક, શાંતિગામ, એસજી હાઇવે, અમદાવાદ - ૩૮૨ ૪૨૧ ફોન નં.: +૯૧-૦૨૪૦-૨૪૪૪૧૦૦/+૯૧-૯૯-૨૬૫૫ ૪૧૦૦ । CIN: L31300DN1961PLC000232 વેબસાઇટ: www.imp-powers.com । ઇમેઇલ આઇડી: info@imp-powers.com પોસ્ટલ બેલેટની નોટીસ (રિમોટ ઈ-વોટિંગ મારફત)

આથી નોટીસ આપવામાં આવે છે કે , કંપનીઝ એક્ટ , ૨૦૧૩ ("અધિનિયમ") ની ક્લમ ૧૦૮ , ૧૧૦ અને અન્ય લાગુ પડતી જોગવાઇઓ અનુસાર , જે સમયાંતરે સુધારેલા કંપનીઓ (વ્યવસ્થાપન અને વહીવટ) નિયમો , ૨૦૧૪ ("નિયમો") ના નિયમ ૨૦ અને ૨૨ સાથે વાંચવામાં આવે છે અને સેળી (લિસ્ટિંગ જવાબદારીઓ અને ડિસ્ક્લોઝર આવશ્યકતાઓ) નિયમન ૨૦૧૫ ("લિસ્ટિંગ નિયમનો" ઝને જનરલ પરિપત્ર નં. ૨૦/૨૦૨૦ તારીખ ૫ મે , ૨૦૨૦ , જે તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલ દ્વારા જારી કરાચેલ જનરલ પરિપત્ર નં. ૦૩/૨૦૨૫ તારીખ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫ ("MCA પરિપત્રો" દ્વારા સુધારેલ છે, અને સેબી પરિપત્ર નં. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 તારીખ ઓક્ટોબર, ૨૦૨૪ ("SEBI પરિપત્ર"), જનરલ મીટિંગ્સ પર સેક્રેટરિચલ સ્ટાન્ડર્ડ (SS-2) દ્વારા જાર્ર કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા અને અન્ય લાગુ કાયદાઓ અને નિચમો , જે સમયાંતરે સુધારેલા છે (કોઈપણ કાયદાકીય સુધારા(ઓ) અથવા હાલ અમલમાં રહેલ પુનઃઅધિનિચમો સહિત), દ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપની ૧૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પોસ્ટલ . બેલેટ નોટિસ **("પોસ્ટલ બેલેટ નોટિસ")** માં દર્શાવેલ ખાસ વ્યવસાચો માટે સભ્યોની મંજૂરી માંગી રહી છે. સભ્યોને જાણ કરવામાં આવે છે કે પોસ્ટલ બેલેટ નોટિસ , સંબંધિત સ્પષ્ટીકરણ નિવેદન અને રેમોટ ઇ-વોટિંગ માટે રિમોટ ઇ-વોટિંગ સૂચનાઓ સાથે , ફક્ત ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવી ઇ અને ગુરુવાર, ૨૦ નવેમ્બર ૨૦૨૫ ના રીજ પૂર્ણ કરવામાં આવી છે જે સભ્યોએ કંપની અથવા ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ સરનામાં પર કટ-ઓફ તારીખ એટલે કે , શુક્રવાર , ૧૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ તેમના રજિસ્ટર્ડ ઇમેઇલ સરનામાં પર નોંધણી કરાવી છે. શુક્રવાર, ૧૪ નવેમ્બર ૨૦૨૫ ("કટ-ઓફ તારીખ") ના રોજ નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટર્ર લિમિટેડ ('NSDL') અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ ('CDSL') તરફથી પ્રાપ્ત યચેલા સભ્યોના રજિસ્ટર/લાભાર્થી માલિકોની યાદીમાં જેમના નામ દેખાયા છે તેમના ઇમેઇલ સરનામાં પર પોસ્ટલ બેલેટ નોટિસ મોકલવામાં આવી છે. તે મુજબ, આ પોસ્ટલ બેલેટ માટે પોસ્ટલ બેલેટ ફોર્મ અને પ્રીપેડ બિઝનેસ રિપ્લાય પરબિડીચું સાથે નોટિસની ભૌતિક નકલ સભ્યોને મોકલવામાં આવી નથી અને સભ્યોએ તેમની સંમતિ અથવા અસંમતિ ફક્ત રિમોટ ઈ-વોર્ટિંગ સિસ્ટમ દ્વારા જ જણાવવી જરૂરી છે. મતદાન અધિકારો કટ-ઓફ તારીખે સભ્યોના નામે નોંધાયેલા શેરન -ચૂકવેલ મૂલ્ય પર ગણવામાં આવશે. જે વ્યક્તિ કટ-ઓફ તારીખે સભ્ય નથી, તેમણે આ નોટિસને ફ્કત માહિતીના હેતુ માટે ગણવી જોઈએ.

જે સભ્યોએ પોતાનું ઇ-મેલ સરનામું રજીસ્ટર કરાવ્યું નથી અને પરિણામે પોસ્ટલ બેલેટ નોટિસ મેળવી શક્યા નથી , તેઓ https://instavote.linkintime.co.in લિંક પર ક્લિક કરીને કંપનીના રજિસ્ટ્રાર ઝને શેર ટ્રાન્સફર એજન્ટ ("RTA"), MUFG Intime India Private Limited પાસે અસ્થાયી રૂપે પોતાન્ ઈ-મેલ સરનામું રજીસ્ટર કરાવી શકે છે. ઇમેઇલની સફળ નોંધણી પછી, સભ્યને નોટિસની સોફ્ કોપી અને ફોસ-વોટિંગ પ્રક્રિયા, યુગ્રર આઇડી અને પાસવર્ડ સાથે મળશે જેથી આ પોસ્ટલ બેલેટ માં ઈ-વોટિંગ સક્ષમ બને. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં , સભ્ય investor.helpdesk@in.mpms.mufg.com પર લખી શકે છે.

યમો , સામાન્ય પરિપત્રો અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સના નિયમન ૪૪ સાથે વાંચેલા કાયદાની ક્લ oc ની જોગવાઈઓ અનુસાર, કંપની તેના સભ્યોને RTA દ્વારા પૂરી પાડવામાં આવેલ રિમોટ ઈ વોટિંગ સુવિધા દ્વારા પોસ્ટલ બેલેટ નોટિસમાં સૂચિબદ્ધ વસ્તુઓના સેંદર્ભમાં ઇલેક્ટ્રોનિક રીતે તેમન મતનો ઉપયોગ કરવાની સુવિદ્યા પૂરી પાડી રહી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિમોટ ઈ-વોટિંગ મોડ દ્વારા પોસ્ટલ બેલેટની પ્રક્રિયાને વાજબી અ

પારદર્શક રીતે હાથ ઘરવા માટે સ્કુટિનાઇઝર તરીકે શ્રીમતી શિલ્પા શાહ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી. (સભ્યપદ નં. ACS ૧૫૨૩૨) ની નિમણૂક કરી છે. LODR રેગ્યુલેશન્સ હેઠળ આવશ્ચકતા મુજબ . પનીએ કંપનીના સભ્યોને ઇલેક્ટ્રોનિક રિમોટ ઇ-વોટિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે MUFG ાન્ટાઇમ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ ("MUFG") ની સેવાઓનો ઉપયોગ કર્યો છે. રિમોટ ઇ-વોટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા સૂચનાઓ પોસ્ટલ બેલેટ નોટિસનો ભાગ બનાવે છે. રિમોટ ઈ-વોટિંગ સુવિદા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્દ છે:

34 01.	Idaldi	EMMANO					
1	રિમોટ ઈ-વોટિંગ શરૂ થવાની તારીખ અને સમય	શુક્રવાર, ૨૧ નવેમ્બર, ૨૦૨૫, સવારે ૦૯:૦૦ વાગ્યે					
2	રિમોટ ઈ-વોટિંગની સમાપ્તિ તારીખ અને સમય	શનિવાર, ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫, સાંજે ૦૫:૦૦ વાગ્યે					
3	રિમોટ ઈ-વોટિંગને આનાથી વધુ મંજૂરી આપવામાં આવશે નહીં	શનિવાર, ૨૦ કિસેમ્બર, ૨૦૨૫, સાંજે ૦૫:૦૦ વાગ્યે					
સભ્યોન	ને જાણ કરવામાં આવે છે કેઃ(૧) સભ્યો ફક્ત RT i	ੈ द्वारा पूरी पाऽवामां आवती रिभोट ई-					
	સુવિધા દ્વારા જ મતદાન કરી શકે છે કારણ કે કંપ						
	પ્રામાં આવી રહ્યું નથી અથવા રવીકારવામાં આવશે						
अने छ	મેઇલ નોંધણી માટેની પ્રક્રિયા કંપનીની વેબસાઇટ	www.imp-powers.com પર ઉપલબ્ધ છે.					
પોસ્ટલ	जेवेट नोटिस तेमक संजंधित जुवासा निवे	हन साथे BSE विभिटेडनी वेजसाएट					
	oseindia.com) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓ						
("22)5	એક્સચેન્જ" જ્યાં કંપનીના ઇક્વિટી શેર ર	(ચિબદ્ધ છે) પર RTA ની વેબસાઇટ					
https://	instavote.linkintime.co.in પર પણ ઉપલબ્ધ છે.(૩) પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન (રિમોટ ઈ-					
	દ્વારા) ના પરિણામો રિમોટ ઈ-વોટિંગ બંધ થયાન						
	. જાહેર કરાચેલા પરિણામો અને સ્કુટિનાઇઝરનો						
	नी वेजसाएट અने RTA नी वेजसाएट https://						
	કરાવવામાં આવશે, ઉપરાંત કંપનીના શેર જ્યાં સૂચિબદ્ધ છે તે સ્ટોક એક્સચેન્જોને પણ જાણ						
	કરવામાં આવશે.(૪) કોઈપણ પ્રશ્નો/સમસ્યાઓના કિસ્સામાં , તમે https://instavote.linkintime.co.in						
	ાર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને InstaVote ઇ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકો						
	છો , મદદ વિભાગ હેઠળ અથવા investor.helpdesk@in.mpms.mufg.com પર ઇમેઇલ મોકલી શકો						
	છો અથવા શ્રી રાજીવ રંજન - આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, MUFG Intime ઇન્ડિયા પ્રાઇવેટ						
લિમિટેડ	લેમિટેડનો ૦૨૨-૪૯૧૮૬૦૦૦ પર સંપર્ક કરી શકો છો. બોર્ડના આદેશથી						
		આર્શએમપી પાવર્સ લિમિટેક વર્તી					

તારીખ : ૨૦.૧૧.૨૦૨૫ अभ्याता : जान्य

DIN: 00421920





Jai Jalaram Bapa **Septic Tank Cleaner** ખાળ કુવાની સફાઈ खार कुवे की सफार्ड

TANKER CAPACITY 8000 LITER WATER JETTING, AIR BLOWING, VACUUMING

પાણીના પ્રેશરથી હવા મારીને ઢાંકી સાફ કરી આપવામાં આવશે. આધુનીક મશિનરી થી કામ કરી આપવામાં આવશે.

Contact: 99046 44348, 98247 28200

Photo

FRIDAY, NOVEMBER 21, 2025

FINANCIAL EXPRESS

Seema Sharan

Authorised Officer

Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers, Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in

PUBLIC NOTICE

Email – ubin0553352@unionbankofindia.bank


Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Sr. No. Name of the Account Borrower / Guarantor

1.	Aastha Sarees	Manish Bhai J Pansuriya (Borrower)
2.	Aastha Sarees	Satishkumar Gopalbhai Patel (Guarantor)

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein: Sd/

Authorised Officer Date: 19.11.2025 **Union Bank of India**



Zonal Stressed Assets Recovery Branch, Meher Chambers, Ground Floor, Dr.Sunderlai Behal Marg, Ballard Estate Mumbai 400001

POSSESSION NOTICE (For Immovable Property) [Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

WHEREAS

The undersigned being the Authorized Officer of Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 04.12.2019 calling upon the borrowers/Directors/guarantors/mortgagors M/s. Suntana Textile Mills Pvt. Ltd., Mr. Rishi Sunil Agarwal , Mr. Sunil Chiranjilal Agarwal, Mrs. Bharti C Agarwal to repay the amount mentioned in the notice being Rs. 12,45,66,000 (Rupees Twelve Crore Forty Five Lakhs Sixty Six Thousand only) within 60 days from the date of the receipt of said notice.

The borrowers/Directors/guarantors/mortgagors M/s. Suntana Textile Mills Pvt. Ltd. Mr. Rishi Sunil Agarwal, Mr. Sunil Chiranjilal Agarwal, Mrs. Bharti C Agarwal having failed to repay the amount, notice is hereby given to the borrower / guarantors/mortgagors and the public in general that the undersigned has taken Physical Possession of the property described herein below in exercise of powers conferred on him / her under Sub-Section (4) of section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 19" day of November of the year 2025.

The borrowers/Directors/guarantors/mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the - Bank of Baroda for an amount Rs. 12.45.66.000 (Rupees Twelve Crore Forty Five Lakhs Sixty Six Thousand only) and interest thereon less

The Borrowers attention is invited to the provision of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property: Bungalow No.132-A, lying and situate at Sector No.2 of Rameshwar Vaibhay, village Tadgaon, Taluka Sudhagad, District Raigad, admeasuring plot area 500 Sq. mt. or 5382 Sq. ft. bearing Plot No.429 and admeasuring built up area of 1183 sq.ft (109.90 Sq. mt.), belongs to Mrs. Bharti C Agarwal

Authorized Officer Date: 19/11/2025 (Bank of Baroda) Place: Sudhagad



Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers, Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in Email – ubin0553352@unionbankofindia.bank **PUBLIC NOTICE**

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Photo	Sr. No.	Name of the Account	Borrower / Guarantor
	1.	Mahavir Trading Co.	Bharti Nilesh Savla (Proprietor)
	2.	Mahavir Trading Co.	Nilesh Niranjan Savla (Guarantor)
	3.	Mahavir Trading Co.	Niranjan Umershi Savla (Guarantor)
N/A	4.	Mahavir Trading Co.	Mahavir Cashew Industries (Guarantor)

Bank has sent suitable communication to the borrower(s) / quarantor(s) informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large. Sd/

Authorised Officer Date: 19.11.2025 **Union Bank of India**



Zonal Stressed Assets Recovery Branch, Meher Chambers, Ground Floor, Dr.Sunderlal Behal Marg, Ballard Estate Bank of Baroda Mumbai 400001

OSSESSION NOTICE (For Immovable Property) [Rule 8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

WHEREAS

The undersigned being the Authorized Officer of Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 and/or 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 02.08.2024 calling upon the borrower/directors guarantors/mortgagors M/s. Emark Energisers Private Limited, Mr. Mahesh Kumar Shah, Mr. Asgerali Fakruddin Fakri, Mr. Rajesh Shah, Mrs. Kalpana Mahesh Shah and Mrs. Jyoti Rajesh Shah to repay the amount mentioned in the notice being Rs.11,82,42,499.91 (Rupees Eleven Crore Eighty Two Lakhs Forty Two Thousand Four Hundred Ninety Nine and Ninety One paisa) and other applicable charges within 60 days from the date of the receipt of said notice.

The borrower/directors/guarantors/mortgagors M/s, Emark Energisers Private Limited Mr. Mahesh Kumar Shah, Mr. Asgerali Fakruddin Fakri, Mr. Rajesh Shah, Mrs. Kalpana Mahesh Shah and Mrs. Jyoti Rajesh Shah having failed to repay the amount notice is hereby given to the borrower/directors/guarantors/mortgagors and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him / her under Sub-Section (4) of section 13 of the Act read with rule 8 and/or 9 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 19" day of November of the year 2025.

The borrower/directors/guarantors/mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the – Bank of Baroda for an amount Rs.11,82,42,499.91 (Rupees Eleven Crore Eighty Two Lakhs Forty Two Thousand Four Hundred Ninety Nine and Ninety One paisa)) and other applicable charges and interest/charges thereon. The Borrowers attention is invited to the provision of sub-section (8) of Section 13 of the

Description of the Immovable Property:

Act, in respect of time available, to redeem the secured assets.

Boundaries for Plot No.27:

Lease hold rights of factory Land & Building at Plot No. B-27 area admeasuring 1800 Sq. meters along with factory building and B-28 area admeasuring 1800 Sq. meters along with factory building, situated at additional industrial area of Mahad, MIDC, village Birwadi, Taluka Mahad, District and Registration District Raigad, Maharashtra- 402301, in the name of M/s Emark Energisers Private Limited

Boundaries for Plot No.28;

East: Road R/w 20 m East: Road R/w 20 m. West: Plot No. B-14 & B-15 West: Plot No. B-14 North: Plot No. B-27 North: Plot No. B-26 South: Plot No. B-28 South: Road R/w 25 m. furniture, fixtures and fittings lying there in"

Together with building/ structures constructed thereon with plant and machinery,

Authorized Officer Date: 19/11/2025 (Bank of Baroda) Place: Mumbai



Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers, Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in **Email** – ubin0553352@unionbankofindia.bank

PUBLIC NOTICE

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due

process prescribed therein:				
Photo	Sr. No.	Name of the Account	Borrower / Guarantor	
	1.	Shahin Enterprises	Shahin Salim Sayyad (Proprietor)	

Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s) informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Authorised Officer Date: 19.11.2025 Union Bank of India



Photo

Union Bank

Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers, Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in **Email** – ubin0553352@unionbankofindia.bank

PUBLIC NOTICE

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Sr. No. Name of the Account Borrower / Guarantor

	1.	M/s. Mapleleaf Epicurea Private Limited	Niraj Murarka (Director)
	2.	M/s. Mapleleaf Epicurea Private Limited	Monali Murarka (Director)
N/A	3.	M/s. Mapleleaf Epicurea Private Limited	Darsh Muruka (Director)

Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s) informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large. **Authorised Officer** Date: 19.11.2025 Union Bank of India



Union Bank Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers,

Email – ubin0553352@unionbankofindia.bank **PUBLIC NOTICE** Notice is hereby given to the public at large that Union Bank of India has

Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in

declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Photo	Sr. No.	Name of the Account	Borrower / Guarantor
	1.	Mahavir Cashew Industries	Bharti Nilesh Savla (Partner)
C B and	2.	Mahavir Cashew Industries	Nilesh Niranjan Savla (Partner)
		Maharia Gasharr	Divush Hamahand

Pivush Hemchand Mahavir Cashew Gogri (Partner) **Industries** Niranjan Umershi **Mahavir Cashew** Savla (Guarantor) **Industries**

Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s) informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Authorised Officer Date: 19.11.2025 **Union Bank of India**

> FORM G INVITATION FOR EXPRESSION OF INTEREST FOR **BIG FLICKS PRIVATE LIMITED** OPERATING IN THE FILM PRODUCTION, FILM MANUFACTURING,

(L	AND CINEMA INFRASTRUCTURE INDUSTRY AT MUMBAI (Under sub-regulation (1) of regulation 36A of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016)					
	RELEVANT P	ARTICULARS				
1.	Name of the Corporate Debtor along with PAN/ CIN/ LLP No.	Big Flicks Private Limited CIN: U92120MH2007PTC168172 PAN: AADCB0671Q				
2.	Address of the Registered Office	Regd. Office: 502, Plot No. 91/94 Prabhat Colony, Santacruz (East), Mumbai City, Mumbai, Maharashtra, India, 400055				
3.	URL of website	Not Available				
4.	Details of the place where the majority of fixed assets are located	The Corporate Debtor does not have any fixed assets as per the financial statements for the FY 2023-24.				
5.	Installed capacity of main products/ services	The Corporate Debtor has no installed capacity for its main products/services.				
6.	Quantity and value of main products/ services sold in the last financial year	No sale of main products/services was made as per the last available financial Statement of FY 2023-24.				
7.	Number of employees/workmen	No information available				
8.	Further details including last available financial statements (with schedules) of two years, lists of creditors, relevant dates for subsequent events of the process are available at:	Details can be sought by sending email at cirp.bigflicks@npvinsolvency.in				
9.	Eligibility for resolution applicants under section 25(2)(h) of the Code is available at :	Details can be sought by sending email at cirp.bigflicks@npvinsolvency.in				

06-12-2025

16-12-2025

21-12-2025

31-12-2025

No information available

Last date of receipt of expression

11. Date of issue of the provisional list

12. Last date of submission of

of Interest

Date: November 21, 2025

Place: Ahmedabad

13. Date of issue of the final list of

17. Details of the Corporate Debtor's

registration status as MSME

of prospective resolution applicants

objections to the provisional list

prospective resolution applicants

Date of issue of information 05-01-2026 Whilst care is taken prior to acceptance of memorandum, evaluation matrix. advertising copy, it is not possible to verify and request for resolution plans to its contents. The Indian Express (P.) prospective resolution applicants Limited cannot be held responsible for 15. Last date for submission of 04-02-2026 such contents, nor for any loss or damage resolution plans incurred as a result of transactions with 16. Process email id to submit Expression cirp.bigflicks@npvinsolvency.in companies, associations or individuals

advertising in its newspapers or IPE - NPV Insolvency Professionals Private Limited (Formerly Known as Mantrah Insolvency Professionals Private Limited) Through its Director - Mr. Ritesh Prakash Adatiya otherwise acting on an advertisement in Resolution Professional any manner whatsoever. Registered Big Flicks Private Limited (In CIRP) letters are not accepted in response to box IBBI Reg. No: IBBI/IPE-0040/IPA-2/2022-23/50021 Validity of AFA: December 31, 2025 Email for Correspondence - cirp biglies of December 31, 2025 alexpress.com

Union Bank

Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers,

Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in Email – ubin0553352@unionbankofindia.bank

Sr. No. Name of the Account | Borrower / Guarantor

PUBLIC NOTICE

Photo

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner /Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

	1.	Karan Singh	Karan Singh (Borrower)
	2.	Karan Singh	Taneeshka Karan Singh (Guarantor)
Bank has sent suita	able co	mmunication to the bo	rrower(s) / guarantor(s)

informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Authorised Officer Date: 19.11.2025 **Union Bank of India**

केनरा बैंक Canara Bank

Lamington Road Branch: 167; Navyug Nivas, Lamington Road, Opp. Minerva Cinema, Grant Road East, Bharat Nagar, Grant Road, Mumbai, Maharashtra 400007

POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) Whereas: The undersigned being the Authorised Officer of the Canara Bank

Mumbai Lamington Road Branch, appointed under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 31.07.2025 calling upon the borrower and Guarantor, Mr. Rohit Sharad Dhole to repay the amount mentioned in the notice, being Rs. 63,71,775.50 (Rupees Sixty Three Lakhs Seventy One Thousand Seven Hundred Seventy five and paise Fifty only), as on 25.07.2025 plus interest due and other cost within 60 days from the date of receipt of the said notice.

The Borrower/Guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general, that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13 (4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 18th day of November 2025. The Borrower in particular and the public in general are hereby cautioned not to deal

with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank Mumbai Lamington Road Branch for an amount of Rs. 63, 71,775.50 (Rupees Sixty Three Lakhs Seventy One Thousand Seven Hundred Seventy five and paise Fifty only), as on 25.07.2025 plus interest due and other cost. The borrower's attention is invited to the provisions of Section 13 (8) of the Act, in respect of time available, to redeem the secured assets. Description of the Immovable Property Name of Title Holder

		Control of the Contro
12	Flat No. 603, admeasuring 46.19 sq mtrs. Carpet Area on 6th floor in Building Known as Shreeji Darshan, Constructed on land bearing Plot No. 88, Sector No. 25 A of Village- Pushpak Node (Vahal), Taluka – Panvel, District- Raigad CERSAI security id – 400077167860	

Sd/-

Authorised Officer Place: Mumbai Canara Bank Type of Possession: PHYSICAL

 Rohit Sharad Dhole, Flat No. 0204, Plot -1, EWS Bldg, E – 1 sector-10, Neer Sai Baba Temple, Ghansoli, Navi Mumbai (M-Corp) Maharashtra - 400701 2. Rohit Sharad Dhole, Flat No. 204, 2nd floor, Sadguru krupa, Plot No -19, Village Chinchavli Shekin Taluka - Khalapur, Distt-Raigad-410203

3. Rohit Sharad Dhole, Flat No. 603, 6th floor, Shreeii darshan, Plot no. - 88, sector 25A, Village – VahalNode Pushpak, Neer Vitthal Mandir, Ulwe, Navi Mumbai, Taluka -Panvel, Distt-Raigad, Pin-410206

4. Rohit Sharad Dhole, Yenere, Yenere, Pune, Maharashtra - 410502

IMP IMP POWERS LIMITED

Date: 18.11.2025

Registered Office: Survey No. 263/3/2/2, Village Sayli, Umar Kuin Road, Silvassa, Dadra & Nagar Haveli - 396 230

Office: CH-7, Inspire Business Park, Shantigram, SG Highway, Ahmedabad - 382 42 Tel. No.: +91-0260-2464100/+91-79-2655 4100 | CIN: L31300DN1961PLC000232 Website: www.imp-powers.com | Email ID : info@imp-powers.com

NOTICE OF POSTAL BALLOT (THROUGH REMOTE E-VOTING) NOTICE is hereby given, pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), read together with Rule 20 & 22 of the

Companies (Management and Administration) Rules, 2014 ("Rules") as amended from time to time and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015 ("Listing Regulations") and General Circular No. 20/2020 dated 5th May, 2020, latest amended b General Circular No. 03/2025 dated 22nd September, 2025 issued by issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), and SEBI Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated 3rd October, 2024 ("SEBI Circular"), Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and other applicable laws and regulations, as amended from time to time (including any statutory modification(s) or re-enactment thereof for the time being in force), that the Company is seeking approval of members for the special businesses as set out in the postal ballot notice dated 10th November 2025 ("Postal Ballot Notice"). Members are informed that the Postal Ballot Notice alongwith relevant Explanatory Statement and remote e-voting instructions for remote e-voting have been sent only by E-mail and completed on Thursday, 20th November 2025 to members who have registered their email addresses with the Company or Depository Participant(s) on the

registered email addresses as on the cut-off date i.e., Friday, 14th November 2025. The Postal Ballot Notice has been sent to email addresses of those members whose names appeared in the Register of Members/List of Beneficial Owners as received from the National Securities Depository Limited ('NSDL') and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, 14th November 2025 ("the Cut-Off Date"). Accordingly, physical copy of the notice alongwith postal ballot form and prepaid business reply envelop has not been sent to the Members for this postal ballot and members are required to communicate their assent or dissent only through remote e-voting system. The voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name of members as on the cut-off date. A person who is not a member as on the Cut-Off Date should treat this notice for information purpose only.

Members who have not registered their e-mail address and in consequence could not receive the Postal Ballot notice may temporarily get their e-mail address registered with the Company's Registrar and Share Transfer Agent ("RTA"), MUFG Intime India Private Limited, by clicking the ink: https://instavote.linkintime.co.in. Post successful registration of the email, the membe would get soft copy of the notice and the procedure fore-voting along with the User ID and Password to enable e-voting for this Postal Ballot. In case of any queries, member may write to nvestor.helpdesk@in.mpms.mufg.com.

accordance with the provisions of Section 108 of the Act read with the Rules, the General Circulars and Regulation 44 of the Listing Regulations, the Company is providing facility to its nembers to exercise their votes electronically in respect of items listed in the Postal Ballot Notice through remote e-voting facility provided by RTA.

The Board of Directors of the Company has appointed Ms, Shilpa Shah, Practicing Company

Secretary, (Membership No. ACS 15232), as the Scrutinizer for conducting the process of postal ballot by way of remote e-voting mode in a fair and transparent manner. As required under LODR Regulations, the Company has engaged the services of MUFG Intime (India) Private Limited ("MUFG") to provide electronic remote e-voting facilities to the Members of the Company. The detailed procedure instructions for remote e-voting forms part of the Postal

The remote E-voting facility is available during the following period: Sr.No. Particulars

Schedule Date and time of commencement of remote e-voting | Friday, November 21, 2025 [09:00 A.M. Date and time of end of remote e-voting Saturday, December 20, 2025 [05:00 P.M.] Remote e-voting shall not be allowed beyond Saturday, December 20, 2025 [05:00 P.M.] Members are informed that : (1) Members can vote only through remote e-voting facility

provided by RTA as no physical postal ballot form is being dispatched or will be accepted by the Company. (2) A copy of Postal Ballot Notice and the procedure for registration of email is available at website of the Company www.imp-powers.com. The Postal Ballot Notice alongwith explanatory statement is also available on website of BSE Limited (www.bseindia.com) and on National Stock Exchange of India Limited (www.nseindia.com) ("Stock Exchanges" where the equity shares of the Company are listed) on the website of RTA at https://instavote.linkintime.co.in. (3) The results of the voting by Postal Ballot (through remote e-voting) shall be declared within 2 working days from the closure of remote e-voting. The results declared and the Scrutinizer's report shall be made available at the Registered Office of the Company and on website of the Company and RTA's website at https://instavote.linkintime.co.in/besides/being.communicated to stock exchanges where the Company's Shares are listed. (4) In case of any queries/issues, you may refer to Frequently Asked Quest ions ('FAQs') and InstaVote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or send an email to investor.helpdesk@in.mpms.mufg.com or contact Mr. Rajiv Ranjan - Assistant Vice President, MUFG Intime India Private Limited on 022-49186000 during working hours on all working days. By Order of the Board

> For IMP Powers Limited Rakesh Shah, Chairman DIN: 00421920

Date: 20.11.2025 Place: Ahmedabad

"IMPORTANT" For Advertising in

TENDER PAGES

JITENDRA PATIL

Contact

Mobile No.: 9029012015 **PUBLIC NOTICE**

To WHOMSOEVER IT MAY CONCERN

This is to inform the General Public that following share certificate of Pfizer Limited having its

Registered office at 1802/1901, The Capital, Plot No. C - 70, G Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai, Maharashtra, 400051 registered in name of the Following Shareholder/s have been lost them. Name of the Folio No. Certificate Distinctive Nos. (F.V. Rs.2/-) Shares from to

Shareholder Anant Prasad Singh P0014408 180439 1867869 -1867968 (Deceased) The Public are hereby cautioned against purchasing or dealing in any way with the above

referred share certificates. Any person who has any claim in respect of the said share certificate/s should lodge such claim with the Company or its Registrar and Transfer Agents Kfin Technologies Limited,

Selenium, Tower B, Plot 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally Mandai, Hyderabad, Telangana-500032 TEL: 040 - 67162222 / 18003094001 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificate/s. Dated: 20-11-2025 Name of the Claimant

Union Bank

Place: Mumbai, Maharashtra-400051

Photo

Dalal Street, Fort, Mumbai-400001, Web: https://www.unionbankofindia.co.in Email – ubin0553352@unionbankofindia.bank **PUBLIC NOTICE**

Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers,

Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Nikunj Sales Nikunj Kothari Corporation (Proprietor) Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s)

Sr. No. Name of the Account Borrower / Guarantor

informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Date: 19.11.2025 **Union Bank of India**



PUBLIC NOTICE Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Email – ubin0553352@unionbankofindia.bank

Photo Sr. No. Name of the Account | Borrower / Guarantor Rishit Rashmikant Padmavati Traders Ajmera (Proprietor)

Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s) informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter

(s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Authorised Officer Date: 19.11.2025 Union Bank of India

Union Bank

Asset Recovery Management Branch, Mezzanine Floor, 21, Veena Chambers,

Dalal Street, Fort, Mumbai-400001, **Web**: https://www.unionbankofindia.co.in Email – ubin0553352@unionbankofindia.bank

PUBLIC NOTICE Notice is hereby given to the public at large that Union Bank of India has declared the following Borrower / Partner / Guarantor as Wilful Defaulters in terms of Bank's / RBI's extant rules and regulations, complying with the due process prescribed therein:

Sr. No. Name of the Account | Borrower / Guarantor **Photo** Taneeshka **Karan Singh**

Taneeshka Karan Singh (Borrower) Bank has sent suitable communication to the borrower(s) / guarantor(s)

informing the decision of the Bank to declare him / her / them as Wilful Defaulter (s). As permitted by the Reserve Bank of India, Bank publishes the photographs of the Wilful Defaulters for the information of the public at large.

Authorised Officer Date: 19.11.2025 **Union Bank of India**

APAC FINANCIAL SERVICES PRIVATE LIMITED Corporate Off: Office No. 501, 5th Floor South Annexe Tower 2, One World Center Senapati Bapat Marg, Lower Parel Mumbai - 400013. Email: contactus@apacfin.com DEMAND NOTICE

UNDER THE PROVISIONS OF THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 ("THE ACT") AND THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002, ("THE RULES") APAC HOUSING FINANCE PRIVATE LIMITED is merged / amalgamated into APAC

FINANCIAL SERVICES PRIVATE LIMITED with effect from 29 Jan 2024. That

accordingly, the borrower's loan account with APAC Housing Finance Private Limited stands transferred to APAC Financial Services Private Limited. Thus, all the documents executed by and between the borrowers and APAC Housing Finance Private Limited shall be deemed to have been executed with APAC Financial Services Private Limited ("APAC"). The undersigned being the authorised officer of APAC Financial Services Private Limited under the Act and in exercise of the powers conferred under Section 13(2) of the Act, read with the Rule 3, issued Demand Notice(s) under Section 13(2) of the Act, calling upon the following borrower(s) to repay the amount mentioned in the respective notice(s) within 60 days from the date of receipt of the said notice. The undersigned reasonably believes that the borrower(s) are avoiding the service of the demand notice(s), therefore the service of the demand notice is being affected by affixation and publication as per the Rules. The contents of

Date and Amount . Mitesh Kanji Berdiya HOMELKAL0002030 2. Sheela Mitesh Loan Amount: - Rs. 21.00000/ 20.11.2025 NPA Date: - 09.07.2025 & Rs. 20,10,223.46/-Description of Secured Asset(s): All those pieces and parcels of Residential Property bearing Flat No. 103 on 1st Floor, B-Wing, admeasuring 795 Sq. Ft. Built up Area, of

Details of Loan

Demand Notice

the demand notice(s) are extracted herein below:

Name of the Borrower(s)

the Society known as "Laxmi Park Co-operative Housing Society Limited" standing withing the limits of Gram Panchayat Kalher, Tal.: Bhiwandi. Dist. Thane

this publication together with applicable interest, late payment penalty, bounce charges, cost and expenses etc. till the date of realization of the payment. The borrower(s) may note that APAC Financial Services Private Limited is a Secured Creditor and the loan facility availed by the borrower(s) is a secured debt against the immovable property(ies) being the secured asset(s) mortgaged by the borrower(s)

stipulated time, APAC Financial Services Private Limited shall be entitled to exercise all the rights under Section 13(4) of the Act to take possession of the Secured Asset(s) including but not limited to transfer the same by way of sale or by invoking any other remedy available under the Act and the Rules thereunder in order to realize the dues in he loan account of the borrower(s). APAC Financial Services Private Limited is also empowered to ATTACH AND/OR SEAL the Secured Asset(s) before enforcing the right to sale or transfer. Subsequent to the sale of the Secured Asset(s), APAC Financial Services Private Limited also has a right to initiate separate legal proceedings to recover the balance dues, in case the value of the Secured Asset(s) is insufficient to cover the dues payable by the borrower(s) to APAC Financial Services Private Limited.

This remedy is in addition and independent of all other remedies available to APAC Financial Services Private Limited under any other law. The attention of the borrower(s) is invited to Section 13(8) of the Act in respect of time available, to redeem the Secured Asset(s) and further to Section 13(13) of the Act, whereby the borrower(s) are restrained/prohibited from disposing or dealing with the Secured Asset(s) or transferring the same by way of sale, lease or otherwise (other than in ordinary course of business) any of the Secured Asset(s) without prior written consent from APAC Financial Services Private Limited and non-compliance of the above is an offence punishable under Section 29 of the Act. The copy of the demand notice(s) is available with the undersigned and the borrower(s) may, if they so desire.

Date: 21.11.2025. Sd/- Mukesh Yadav (Authorised Officer) Place: Bhiwandi, Maharashtra

Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or

Landline No.:

67440215

on the plot of land bearing survey no. 82, Hissa No. 6 and 3 of Village Kalher, Tal.: Bhiwandi, Thane- 421301 in the Registration District and Sub District Bhiwandi The borrower(s) are hereby advised to comply with the demand notice(s) and pay the demand amount mentioned therein and hereinabove within 60 days from the date of

with APAC Financial Services Private Limited. In the event, the borrower(s) are failed to discharge their liabilities in full within the

collect the same from the undersigned.

For APAC Financial Services Private Limited